ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવે એ પહેલાં જ ખાણ ખનીજ વિભાગે આપેલી મંજૂરીથી દાળમાં કંઇક કાળુ હોવાની સેવાતી આશંકા

મહુધાના મંગળપુરા ગામે જમીન ફળદ્રપ કરવાના બહાને માટી કૌભાંડ

તલાટીને ભૂલ સમજાતા સુજલામ સુંફલામની મંજૂરી માટે મામલતદાર પાસે દોડી ગયા પણ તેઓએ હાથ અદ્ધર કરી દેતા બરાબરના સલવાયા

માટે લઈ જવાની મંજૂરી આપવાની દારા કોઈ પગલા લેવાતા નથી. હોય છે. સુજલામ સુફલામ યોજના દ્વારા પણ ખેડૂતોને તળાવની માટી ગામની સર્વે નંબર ૨૪૫/૨૪૬ વાડી હતો હવે જ્યારે તલાટીએ ગ્રામ પોતાના ખેતરની ફળદ્રુપ કરવા જમીનને ફળદ્રુપ બનાવવા માટે પંચાયતની મિટિંગ મળી અને સર્વ માટે મંજૂરી આપવામાં આવતી ખેડૂત દ્વારા માંગણી કરવામાં આવતા સંમતિથી ૨૨/ ૩/ ૨૦૨૨ના રોજ હોય છે.જેની આડમાં કેટલાય તલાટી તેમજ સરપંચ અને સભ્યોએ ઠરાવ કર્યો તો ખાન ખનીજ ૧૫ /૨ લોકો પોતાની ખાનગી માલિકીની સર્વાનુમતે મંજૂરી આપી હતી તે /ર૦૨૨ના રોજ એટલે કે ૩૭ દિવસ જગ્યામાં પુરાણ કરાવી દે છે તેવો મંજૂરી જમીન ફળદ્રુપ કરવા ખેતરમાં પહેલા કેવી રીતે મંજૂરી આપી ? બનાવ હાલમાં મહુધા તાલુકાના માટી નાખવાની હતી.આ ઠરાવ સરકારી નિયમોથી અજાણ તલાટીએ મંગળપુરા ગામે બન્યો છે. સામાન્ય તારીખ ૨૨ /૩/૨૦૨૨ ના રોજ તળાવમાંથી માટી ખોદવાની પ માણસ કાયદાનું ઉલ્લંઘન કરે કરવામાં આવ્યો હતો જ્યારે ખાણ રવાનગી મામલતદાર પાસે માગી

સરકાર દ્વારા ખેડૂતોને પોતાની ખેતર સામતલ કરવાની મંજૂરી બનાવવા માટે ગુજરાત ખનિજ જમીન ફળદ્રુપ કરવા માટે તેમ આપ્યા બાદ માટી ખાનગી હેતુ છુટછાટ ૨૦૧૭ પ્રમાણે જમીન જ તળાવો ઉંડા કરવા માટે ગ્રામ માટે ગેરકાયદે ઉપયોગમાં લેવાર્તો ફળદ્રુપ બનાવવા માટે રોયલ્ટી પંચાયતમાં ઠરાવ કરી રોયલ્ટી વગર હોવાની જાણ થયા બાદ પણ તંત્ર લેવામાંથી છૂટ આપી હતી, પરંતુ

તો તેને સજા વેઠવી પડે છે, પરંતુ ખનીજ વિભાગ દ્વારા ખેતરમાંથી હતી. જે બાબતે મામલતદારને કોઈ

આ મંજૂરીનો પત્ર તલાટી કમ મંત્રીને મહુધા તાલુકાના મંગળપુરા ગામે ૧૫/ ૨ /૨૦૨૦ ના રોજ મળ્યો

ગામના તળાવમાંથી માટી કાઢી માટી કાઢવા તેમજ જમીનને ફળદ્રુપ લેવાદેવા હોતી નથી તે સ્થાનિક અંતર્ગત માટીની માટેની મંજૂરી ધોરણે નિયમ અનુસાર કાર્ય કરવાનું કરવાની હોય છે જ્યારે તલાટી મહુધાને ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર જાણ કરી હતી.

જેથી મામલતદારે તે જ દિવસે પંચાયતને લેટર પાઠવ્યો હતો કે આ મંજૂરી મારે આપવાની ના હોય તેમજ

માગી હતી. પરંતુ સમયમર્યાદા પ હોય છે. મામલતદારને સુજલામ ૂર્ણ થઇ જતાં મામલતદારે મંજૂરી સુકલામ યોજના અંતર્ગત તળાવો આપેલ નથી તો તારીખ ૨૮ /૪ ઉંડા કરવા કે ખાડા કરવાની જાણ /૨૦૨૨ ના રોજ તલાટી તેમજ સરપંચે મામલતદારને તેમજ તાલુકા આખા કૌભાંડમાં સંડોવાયા હોય વિકાસ અધિકારીને લેખિત જાણ તેવી ભીતિ થતાં મામલતદાર કરી હતી કે સર્વે નંબર ૨૪૫/૨૪૬ ના ખેડૂતે ૨૦૦ કરતા વધારે ટ્રોલી માટી કાઢી હોવાથી અમે તપાસ કરવા ગયા ત્યારે તેઓએ અમારો મોબાઈલ લીધો હતો, તેમજ અમારી પાસે ગેરવર્તણૂક કરી હતી. મંગળપ તમે નિયમોનુસાર કાર્ય કરશો જ્યારે ુરા ગામ એ જે જગ્યાએ માટીપુરાણ પોતાનો બચાવ શોધતા તલાટીએ કરવામાં આવ્યું છે, તે જગ્યાએ હાલમાં બે દિવસ પહેલા મામલતદાર ખેતર ની જગ્યાએ ફાર્મહાઉસ કચેરીએ સુજલામ સુફલામ યોજના બનતું હોવાની વાત બહાર આવી

મારે મંજૂરી આપવાની ના

હોચ : મામલતદાર મંગળપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મારી પાસે તળાવમાંથી માટી કાઢવાની મંજૂરી માટે આવ્યા હતા પરંતુ તે સુજલામ્ સુકલામ્ યોજુનાના હોવાથી અને તે ગામનો

પ્રશ્નો હોય પંચાયત તરફથી મંજૂરી

મેળવવાની હોય છે.

છે. જે સ્થળે ખેતર હોય તે સ્થળે માત્ર પોતાની ખેતી થાય તેટલા જ ઓજારો મૂકી શકાય માત્ર જેટલું ઘર રહેવા માટે બનાવવાનું હોય છે, પરંતુ હાલમાં ત્યાં બાળકો મોટું મકાન બની ગયું છે તેમજ જમીનની ચારેતરફ દિવાલ પણ બનાવી દેવામાં

આપવામાં આવી હતી. આ

કાર્યક્રમમાં અગલ અલગ સંસ્થાના

મહાનુભાવો હાજર રહ્યા હતા. વડોદરામાં ગુજરાત રીફાઇનરીની

કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબિલીટી

(સીએસઆર) પ્રવૃત્તિ હેઠળ વિવિધ

સાધન સહાયનું વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યના ભુપેન્દ્ર પટેલે ૩૧૦ લાભાર્થીઓને સહાયનું

વિતરણ કર્યું હતું જેમાં મોટોરાઇઝડ

ટ્રાઇસિકલ, વ્હીલચેર, કાનના મશીન

અને તેને સંલગ્ન સાધનો, સ્માર્ટ

ફોન, મલ્ટી-સેન્સરી ઇન્ક્લુઝીવ

એજ્યુકેશનલ કિટ્સ, બ્રેઇલ કેન્સ,

પ્રોસ્થેટિક લીમ્બ વગેરે સામેલ હતા.

આ ઉપરાંત આર્ટિફિશિલ લીમ્બ

મેન્યુફેક્ચરીંગ કોર્પોરેશન ઓફ

ઇન્ડિયા) (એએલઆઇએમસીઓ)

आज़ादी_क अमृत महोत्स

ખોટો ઠરાવ પાસ કર્યો

ખાણ ખનીજ દ્વારા તારીખ ૧૫/૨/૨૦૨૨ ના રોજ તલાટીને મંજૂરી માટેનો પત્ર પાઠવવામાં આવ્યો હતો ત્યારે તલાટી અને સરપંચે સભ્યોની મંજૂરી સાથેનો ઠરાવ તારીખ ૨૨/૩/૨૦૨૨ ના રોજ કર્યો હતો તો પ્રશ્ન એ છે કે એક મહિના પહેલા ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી કાઢવાની રોયલ્ટી વગર મંજૂરી કેવી રીતે મળી, જે બાબતે ખાણ ખનીજ વિભાગના જિલ્લાની કચેરીનો સંપર્કે કરતાં ત્યાંથી જાણવા મળ્યું હતું કે અમારી પાસે તલાટીએ કરેલ ઠરાવ આવ્યા બાદ જ અમે સામે પત્રનો જવાબ આપ્યો હતો જેનો મતલબ કે એક કામ માટે બે વખત ઠરાવ કરવામાં આવ્યા હતા.

તલાટી દ્વારા અણછાજતું વર્તન

મંગળપુરા માટી કૌભાંડ બાબતે તલાટીને વાત કરતા તેલાટીએ ગ્રામ પંચાયતે આવવાનું કહી તલાટી સીધા ધારાસભ્ય પાસે પહોંચી ધારાસભ્યો સાથે વાત કરાવી આ મુદ્દામાં ન પડવા તેમજ બધા જ કાગળો વ્યવસ્થિત હોવાનું જણાવતા હતા તેમજ તલાટી ફોન પર પણ વાત કરવાનું ટાળતાં અને ફોન રિસીવ કરતા ન હતા અને રૂબરૂ મળતા પોતે સાફ હોવાનું જણાવતા હતા.

વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદ ખાતે વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત દસ દિવસીય સંસ્કૃત વર્ગની પૂર્શાહૂતિ



વડોદરા, તા.૨૭ વૈશ્વિક જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ દ્વારા વર્ગમાં ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓ આ સમાપન કાર્યક્રમમાં બહોળી જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા સ્કૂલનાં સંસ્થાપક નારાયણ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શીખેલ વિવિધ અભ્યાસો નાટક અને તનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

ઇન્ટરનેશનલ સ્કૂલ આણંદ ખાતે

ચાર વર્ષથી RBIએ રૂ. ૨૦૦૦ની નોટ છાપી નથી

ચાર વર્ષથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ અનુસાર માર્ચ ૨૦૨૨ની

નવી રૂ.૨૦૦૦ની ચલણી નોટ છાપવાનું બંધ કર્યું સ્થિતિએ દેશના ચલણમાં કુલ નોટોમાં રૂ.૨૦૦૦ની

હોવાથી કુલ ચલણમાં આ નોટનો હિસ્સો ઘટી રહ્યો છેં નોટનો હિસ્સો ૧૩.૮ ટકા હતો જે આગલા વર્ષના ૧૭.૩

એવી વિગત દેશની સેન્ટલ બેકના વર્ષ ૨૦૨૧-૨૨ના 🛮 ટકા કરતા ઘટી ગયો છે. માર્ચ ૨૦૨૨ની સ્થિતિએ

૨૦૧૬માં દેશમાં રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ રદ નોટો રહી છે જે આગલા વર્ષે ૨૪૫ કરોડ હતી. જોકે,

કરી તેને બેંકમાં ૬૦ દિવસમાં જમા કરાવી દેવાનો આદેશ રિઝર્વ બેંકે હવે રૂ.૫૦૦ની નોટો વધારે છાપવાનું શરુ

આપવામાં આવ્યો હતો. આ સમયે રદ્દ થયેલી નોટોનું કર્યું છે. રૂ.૩૧ લાખ કરોડના વ્યવહારના કુલ ચલણમાં

પ્રમાણ ઘણું વધારે હોવાથી કેન્દ્ર સરકારે રૂ.૨૦૦૦ની રૂ.૫૦૦ની નોટોનો હિસ્સો ૭૩.૩ ટકા હતો જે ગત વર્ષે

O&M CIRCLE OFFICE, GOTRI ROAD, BARODA-390 021 Tel: 2355520/21 Fax 2313164

barodaom@gebmail.com - E&P Dept-GoG: http://guj-epd.gov.in

CIN U40102GJ2003SGC042907

Tender Notice (1) Tender ID 493983. Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for nandesari S/Dn model-2021(white color Tax/Max passing for 24 hrs/3000 per month under Baroda Dn (2)

Tender ID 493955. Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Baroda Dn Lab model

2021(white color Tax/Max passing for 12 hrs/3000 per month under Baroda Dn (3) Tender ID 493930.

Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Baroda Dn TMS model-2021(white color

Tax/Max passing for 12 hrs/3000 per month under Baroda Dn.(4) Tender ID 492947 Hiring of diese driven close body Jeep model BS-6(6+D) for Baroda Dn Koyali S/Dn model-2021(white color Tax/Ma

passing for 22 hrs/3000 per month under Baroda Dn. (5) Tender ID 493987 Hiring of diesel driven close

body Jeep model BS-6(6+D) for Baroda Dn Sayli S/Dn model-2021(white color Tax/Max passing for 24

MADHYA GUJARAT VIJ COMPANY LIMITED

નવી નોટ બજારમાં મૂકી હતી. જોકે, વર્ષ ૨૦૧૮-૧૯૫ ૬૮.૪ ટકા હતો.

ગત.તા. ૨૫ નારોજ વ્રજભૂમિ વિવિધ કાર્યક્રમો પ્રદર્શિત કર્યા હતા. ડો.દર્શન ભક્ટે વર્ગનું વૃત સંભળાવ્યું આયોજીત દસ દિવસીય સંસ્કૃત શાળાના પ્રાંગણમાં યોજાયો હતો. હતું. કાર્યક્રમનાં અધ્યક્ષ નારાયણ ચરણદાસ સ્વામીજીએ વૈશ્વિક જોડીને સંસ્કૃત ભાષા વિશે સમજ સંખ્યામાં સામાજીક કાર્યકરો ઉપ જ્ઞાનગંગા સેવા ટ્રસ્ટ વિશે વિગતવાર કેળવી હતી. આ વર્ગ દસ દિવસ સ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનાં માહિતી આપીને આ પ્રકારનાં વર્ગો બાદ ગઈકાલે પૂર્ણ થયો હતો. વૈશ્વિક અધ્યક્ષ વ્રજભૂમિ ઇન્ટરનેશનલ અવિરત ચાલતા રહે એવો અનુરોધ કર્યો હતો. આ વર્ગમાં ૧૦૪ બાળકો આયોજિત દસ દિવસીય આવાસીય ચરણદાસ સ્વામીજી હતા. કાર્યક્રમનાં એ દસ દિવસ સુધી વર્ગ સ્થાન પર સંસ્કૃત શિક્ષણનો સમાપન કાર્યક્રમ આરંભમાં બાળકોએ સંસ્કૃતમાં રહી સંસ્કૃત નો અભ્યાસ કરી સંસ્કૃ ભાજપ પ્રમુખ સાથેની સાંઠગાંઠના

છી રિઝર્વ બેંકે આ નવી નોટ છાપવાનું બંધ કરી દીધું છે.

લો હવે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખની છબી ઉજ્જવળ કરવા તરફદારીનું જૂથ મેદાનમાં

માગ કરતી લેખીત રજૂઆત પ્રદેશ પ્રમુખ સમક્ષ કર્યો બાદ કડક શબ્દોમાં ઠપકો આપી મામલો થાળે પાડવાના પ્રયાસ બાદ હવે જિલ્લા આવતા પુનઃ પક્ષમાં ચણભણાટ શરૂ થયાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા એક વર્ષથી આણંદ ભાજપમાં સ્વાયત્ત તથા સ્વરાજકીય સંસ્થામાં સત્તા હસ્તે કરતાં મલાઇ વહીવટ ભાગબટાઇના ખેલ રચવામાં આવતા થોડાસમય પૂર્વ જિલ્લાના બે ઉચ્ચનેતાનો વિખવાદ વિવાદ ઉજાગર થતાં પક્ષના એકજૂથના નેતાના ઇશારે પાલિકા પ્રમુખના પતિરાજના મલાઇ વહીવટના એકમેવ્ય ચોકા સાથે જિલ્લા આક્ષેપ કરી પાલિકા પ્રમુખ

તથા જિલ્લા ભાજપ પ્રમુખના આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજીનામાંની લેખીત માગ પ્રદેશ તથા પાલિકા પ્રમુખના પતિરાજના પ્રમુખ સમક્ષ કરવામાં આવતા એકમેવ્ય મલાઇ વહીવટના પ્રદેશ પ્રમુખ દ્વારા કડક વલણ રચાયેલ ચોકા મુદ્દે પક્ષના કાર્યકરો દાખવી જૂથવાદ તથા ભ્રષ્ટાચારને

હારા બંને પ્રમુખના રાજીનામાંની બંધ કરવાની સુચના આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ છતાં પક્ષમાં ઉકળતા ચરૂની સ્થીતી યથાવત રહેતા હવે ભાજપ પ્રમુખની છબી ઉજ્જવળ જિલ્લા ભાજપ પ્રમુખની પક્ષીય કરવા તરફદારી જૂથ મેદાનમાં ઉજ્જવળ કામગીરી કરી હોવાના તથા પત્રિકા યુદ્ધ દ્વારા ઉભી કરવામાં આવેલ પરિસ્થિતિ તમારી વધતી જતી ક્ષમતાનો ઉચા વધતા

ગ્રાફના કારણે અસંતોષજનક સ્થીતી ઉભી કરી હોય તમારા નેતૃત્વમાં પક્ષ વધુ મજબૂત બની રહ્યાનો મત વ્યક્ત કરી પ્રમુખ તરફી જૂથ સક્રિય બની મેદાનમાં આવતા આગામી દિવસોમાં ધર્ષણની સ્થીતી વણસશે તેવી સંભાવના સાથે ચણભણાટ ઉભો થયો છે.

વડોદરામાં ગુજરાત રીફાઇનરીની સેવાકીય પ્રવૃત્તિ હેઠળ ૩૧૦લાભાર્થીઓને સાધન સહાય રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વડોદરામાં ગુજરાત રીફાઇનરીની કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબિલીટી હેઠળ ૩૧૦ લાભાર્થીઓને વિવિધ સહાય

દ્વારા ઉત્પાદિત ૫૧૬ જેટલા વિવિધ સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત

સાધનો મહિલા તેમજ બાળ વિકાસ રીફાઇનરીના ઇડી એન્ડ આરએચ વિભાગના મંત્રી મનિષાબેન વકીલ, સંજય ભટનાગર અને મેયર કેયુર મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રોકડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



Shri S'ad Vidya Mandal Institute of Technology College Campus, Old N. H. No. 8, Bharuch - 392 001. Email: director@svmit.ac.in Website: www.svmit.ac.in **WANTED FOR AN ENGINEERING COLLEGE**

SVMIT is a premier Institute of this region in the field of technical education since 1996. It is affiliated to Gujarat Technological University (GTU), Ahmedabad. Institute needs the following Faculties and a Principal

1. Professors / Associate Professors:

Sr. No.	Department	Prof.	Assoc. Prof.	Asst. Prof.
1.	Chemical Engineering	01	01	00
2.	Computer Engineering	01	01	00
3.	Marketing & HR		02	

2. Principal: Candidate should have experience and qualifications as per AICTE norms. He / She must possess skill and passion to lead the institute for the need of industries and society.

For the above-mentioned posts of principal and teaching faculty experience and qualification are required as per the AICTE / GTU norms. For Marketing and HR candidates having MBA degree (Marketing / HR) will be given preference.

pply to info@svmit.ac.in and also send hard copies of documents to Institute along with all the supporting documents on or before 11/06/2022.

આરોગ્યજન સુખાકારીહિતાર્થે આણંદમાં મેડકાટૅ દ્વારા જૈનરિક દવાના સ્ટોરનું આયોજન

આશંદ,તા.૨૭ તબીબી સારવાર માધી બનતા વાર્ષિક અહેવાલ ઉપરથી પ્રકાશમાં આવી છે. નવેમ્બર દેશમાં હવે ચલણમાં, રૂ.૨૦૦૦ની કુલ ૨૧૪ કરોડ સામાન્ય વર્ગે માટે મોધી દવાઓથી આર્થિક હાડમારી વધતા મેડકાટૅ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં જૈનરિક દવાના સ્ટોર શરૂ કરવામાં આવશે.સંસ્થાના પરાશર ચારીએ જણાવ્યું કે જૈનરિક દવા દ્વારા સરળ અને પરવડે તેવી સારવારને સુલભ બનાવવાના પ્રયાસ થકી સામાન્ય - મધ્યમ વગૅના પરિવાર સહિત અન્ય માટે પણ આરોગ્ય પાછળ થતાં ખર્ચે ધટશે.દવાઓ બ્રાન્ડેડ નામ જ સાચાની લાગણી ઘર કરી ગઇ હોય તેને ગુણવત્તા સાથે જોડી કિંમતના આકલન કરાતા હોય છે. પરંતુ વાસ્તવમાં મેડીકલ બીલમા ૮૫% સુધીની રાહત મળતી હોય પરવડે તેવી દવાઓ પણ પોતાની ગુણવત્તા અન્ય ઉચી કિંમતની ધરાવતી હોય મહત્તમ ઉપયોગ લેવા પર ભાર મુક્યો હતો.

per AMC Tender Scope of work, Requirements & terms - conditions.

AHMEDABAD MUNICIPAL CORPORATION

CENTRAL WORKSHOP

Short E Tender Notice

Tender No. 149 to 177 / 2022-23 for Supply of Spares, Repair - Fabrication & Servicing work etc. as

Online Submission upto	Date 09/06/2022 up to 18.00 Hrs.
Details and Tenders available on	www.amc.nprocure.com and www.ahmedabadcity.gov.in
	, 00

જાહેર નિવિદા(બીજો પ્રયત્ન)


ઇડર નગરપાલિકા

આથી લાગતા-વળગતાં કોન્ટ્રાકટર, વેપારીઓ, પેઢીઓને જણાવવાનું કે, ઇડર નગરપાલિકા ધ્વારા સને-૨૦૨૨/૨૩ માટે સેનીટેશન શાખા માટે મજુરી સાથેના નીચે મુજબના વાર્ષિક ભાવો મંગાવવામાં આવે છે. તમામ કામોના કોરા ટેન્ડર ફોર્મ તા.૦૨/૦૬/૨૦૨૨ સાંજના ૫.૦૦ કલાક સુધી મેળવવાના રહેશે. ટેન્ડર સાથે નિયત ઇ.એમ.ડી. મોકલવાની રહેશે. સીલબધ ટેન્ડર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, ઇડર નગરપાલિકાને તા.૦૬/૦૬/૨૦૨૨ સુધી મોકલવાના રહેશે.

ક્રમ	કામની વિગત	બાનાની રકમ	ટેન્ડર ફી
٩	જંતુનાશક દવાઓની ખરીદીનું કામ	4000.00	600.00
ર	જે.સી.બી તથા ટ્રેક્ટર પ્રતિ ફેરાના કામ બાબત.	٥٥.000	600.00

સીલબંધ કવર ઉપર કામનું નામ અવશ્ય લખવાનું રહેશે. સમય મર્યાદા પછીના ટેન્ડરો આપો-આપ રદ ગણાશે. ટેન્ડર અંગે વધુ વિગત નગરપાલિકાનો રૂબરૂ સંપર્ક કરવાથી અથવા ટેલીફોન નં. ૦૨૭૭૮-૨૫૦૦૪૬ પરથી જાણી શકાશે. સદર કામ અંગેના તમામ હકક અધિકાર ઇડર નગરપાલિકાને અબાધિત રહેશે.

હરાશ અ ગ્રવાલ	દિનેશભાઇ પરમાર	કુણાલ.ડી.કંસારા	ફાલ્ગુનીબેન ભાવસાર	જયસિંહ.આર.તવર
મુખ્ય અધિકારી	આરોગ્ય ચેરમેન	કારોબારી ચેરમેન	ઉપપ્રમુખ	પ્રમુખ
ઇડર નગરપાલિકા	ઇડર નગરપાલિકા	ઇડર નગરપાલિકા	ઇડર નગરપાલિકા	ઇડર નગરપાલિકા



hrs/3000 per month under Baroda Dn..(6) Tender ID 493990 Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Baroda Dn Waghodia S/Dn model-2021(white color Tax/Max passing for 24 hrs/3000 per month under Baroda Dn.(7) Tender ID 494085 Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Baroda Dn Waghodia S/Dn model-2021(white color Tax/Max passing for 24 hrs/3000 per month under Baroda Dn. (8) Tender ID 494064Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Executive Engineer Jambuva Division model-2021(white color Tax/Max passing fo 12 hrs/2500 per month under Jambuva Dn. (9) Tender ID 494068 Hiring of diesel driven close body Jeer model BS-6(6+D) for Jambuva S/Dn. model-2021(white color Tax/Max passing for 24 hrs/3000 per month under Jambuva Dn. (10) Tender ID 494070 Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Jambuva Division TMS model-2021(white color Tax/Max passing for 12 hrs/3000 per month under lambuva Dn. (11) Tender ID 514317 Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Police Inspector-1 under GUVNL Police Station, Gotri Baroda, model-2022 (white color Tax/Max passing for 24 hrs/3000 per month..(12) Tender ID 494081 Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) fo Karjan-l under Jambuva Division model-2021(white color Tax/Max passing for 24 hrs/3000 per montl under Jambuva Dn. (13) Tender ID 492938 Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for I/c Squad under Baroda Division model-2021(white color Tax/Max passing for 24 hrs/3000 per month (14) Tender ID 493948 Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Executive Enginee Baroda Division under Baroda Division model-2021(white color Tax/Max passing for 12 hrs/3000 pe month. (15) Tender ID 514443 Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Police nspector-3 under GUVNL Police Station, Gotri Baroda. model-2022 (white color Tax/Max passing for 24 nrs/3000 per month. Tender ID 514443.(16) Tender ID 514439 Hiring of diesel driven close body Jee model BS-6(6+D) for Police-Inspector-2 under GUVNL Police Station.Gotri Baroda.model-2022(white color Tax/Max passing for 24 hrs/3000 per month.(17) Tender ID 514396 Hiring of diesel driven close body Jeep model BS-6(6+D) for Police-Inspector under GUVNL Police Station, Gotri Baroda model 2022(white color Tax/Max passing for 24 hrs/3000 per month.(18)Tender ID 494077 Hiring of diese driven close body Jeep model BS-6(6+D) for I/C Squad under Jambuva Division model-2021(white colo Tax/Max passing for 24 hrs/3000 per month under Jambuva Dn. (19) Tender Notice No.BD/10/2021. Tender for printing of Hordings & mounting the same,flex Banners & pamphlets for all division offices unde Baroda(O&M)Circle office to Publicity and Awarness activies under PM-KUSUM scheme (20) Tender Notice No.BD/10/2021. Tender for Purchase of transformer L V coll & HV coll winding machine for in-house transforme repairing centre at Bodeli(O&M)Division Office.(21)Tender Notice No. BC/CVL/WGH/22. Civil work for New adies toilet,printing,Material stacking shed,TC Plinth in GIDC & Other Misc.civil work at Waghodia S/Dr. Under Baroda (O&M)Dn (22) Tender Id No.16534738211. Procurement of 01 No. 10 HP Mono bloc pump at old overhead tank at Vidyutnagar colony and 02 nos. of 1 HP pressure pump for MD GUVNI

residence at Shobha bungalow, Vidyutnagar Colony, OP road, Vadodara.HO/DE(EM)/MONO bloc

site

www

S.E. (O&M) Baroda

gseb.com, www.mgvcl.com

NILA INFRASTRUCTURES LIMITED (CIN: L45201GJ1990PLC013417)

Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bunglow, Bodakdev, Ahmedabad - 380 015. **Phone:** +91 79 4003 6817/18 **Fax:** +91 79 26873922

E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

	EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2022										
_											(₹ in Lakhs
				Standalone					Consolidated		
			Quarter Ended			Ended		Quarter Ended	Year	Ended	
SN	Particulars	31-03-22	31-12-21	31-03-21	31-03-22	31-03-21	31-03-22	31-12-21	31-03-21	31-03-22	31-03-21
	(Refer Notes below)	Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
1	Total Income from Operations	2,756.53	2,744.05	3,841.53	10,613.31	11,111.22	2,435.59	2,535.67	3,864.19	9,422.82	10,596.05
2	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional items	171.43	100.27	590.42	364.85	117.48	139.54	54.25	613.75	176.56	93.65
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional items)	171.43	100.27	590.42	364.85	117.48	139.54	54.25	613.75	176.56	93.65
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)	122.21	73.33	433.77	251.02	49.19	(108.34)	23.91	464.98	(198.16)	(64.99)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	122.58	75.69	442.79	258.44	58.58	(107.97)	26.26	474.00	(190.74)	(55.60)
6	"Equity Share Capital (Face Value of ₹ 1/- per share)"	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89
7	Other Equity (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet)				10,710.52	10,452.08				9,366.67	9,557.41
8	Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)										
	Basic (in ₹)	0.03	0.02	0.11	0.06	0.01	(0.03)	0.01	0.12	(0.05)	(0.02)
	Diluted (in ₹)	0.03	0.02	0.11	0.06	0.01	(0.03)	0.01	0.12	(0.05)	(0.02)

The above is an extract of the detailed format of quarter and year ended Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 27, 2022 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarter and year ended Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.nilainfra.com.

Place: Ahmedabad Date: May 27, 2022

By Order of the Board of Directors Manoj B Vadodaria **Chairman and Managing Director** DIN: 00092053



pump/vidhyut nagar colony/2018.Visit our web

&www.nprocure.com, Be in touch with web site till opening of tender









UP CM IN UTTARAKHAND Dhami could have won had we campaigned together: Yogi

EXPRESS NEWS SERVICE DEHRADUN, MAY 28

ADDRESSING A public rally to campaign for Uttarakhand Chief Minister Pushkar Singh Dhami before the by-election to Champawat, Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Saturday suggested that the result on Khatima seat would have been different had he campaigned there with Dhami.

Dhami had contested unsuccessfully from Khatima in the Assembly polls earlier this year.

Adityanath said, "I was supposed to come for some public meetings during Uttarakhand elections. But suddenly my event at Khatima was cancelled, and my time was rescheduled for Tehri, Kotdwar and other places."

He said, "Due to the honourable Prime Minister's programme in Rudrapur, I wasn't able to visit Khatima. I felt in my heart that if we would have gone to Khatima together, the picture would have been different."

In the Assembly polls, BIP won 47 of 70 seats; the Congress got 19 and BSP and Independents bagged two seats each. While BJP became the first ruling party to return to power in Uttarakhand, Dhami lost the election from Khatima to Congress's Bhuwan Chandra Kapri.

Addressing Saturday's rally along with Dhami, Adityanath also said that the Char Dham shrines in the hill-state -Kedarnath, Badrinath, Gangotri and Yamunotri — are being transformed like Ayodhya, Kashi-Vishwanath and Mathura-Vrindavan in UP. "Now Ayodhya has been transformed — Ramlala's temple is being constructed," he said.

Vertical-lift Pamban Bridge likely to be completed by year-end: Officials

PRESS TRUST OF INDIA RAMESHWARAM, MAY 28

THE CONSTRUCTION of the new Pamban Bridge, a Railways' engineering marvel, will be completed by December with an estimated cost of Rs 560 crore, officials said Saturday.

The two-km bridge is India's first vertical lift sea bridge that would open upwards to let big ships pass through.

It is being developed by the Railway Vikas Nigam Limited.



A view of the new Pamban bridge on Saturday. PTI

POSSESSION HDFC Bank Ltd., 3rd Floor, Shivalik - III, HDFC BANK Above Axis Bank, Near Drive In Cinema, NOTICE Ahmedabad - 380054. Ph : 079 - 61738096

Whereas, the undersigned being the Authorized Officer of the HDFC Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of security Interest Act, 2002 and exercise of powers conferred under Section 13(2) read with the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notice to the Borrowers mentioned herein below to repay the amount mentioned in the notice,

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that the undersigned has taken Symbolic possession of the properties described herein below mentioned date in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules.

Name of Borrowers	Date of Demand Notice & O/s. Dues	Description of the Immovable Properties	Date of Possession
New Patel Furniture, Proprietorship firm through it's Proprietor Suresh Maganlal Patel, Suresh Maganlal Patel, 3) Gayatriben Sureshbhai Patel	28.02.2022 & Rs. 18.23,254.49 as on 25.02.2022 as per u/s 13(2) Notice & Rs. 18.34,646.86 as on 23.05.2022 and interest & expenses thereon	All the piece and parcel of residential property bearing "Bungalow No. 3, Shailaja Bungalows, Nr. Ambikanagar, Ambaji Road, District Patan-384265, situated on the land area admeasuring 162.20 Sq. Meters. having Revenue Survey No. 358 Paikee 2 Paikee 1, known as "Shailaja Bungalows", Bunglow No. 3 of Taluka Patan, District Patan - 384265 and and bounded as under: East; Plot No. 04, West: Plot No. 02, North: Ambaji Road, South: Plot No. 21.	23.05.2022
Shrinathji Traders, Proprietorship firm through it's Proprietor Devjibhai Bababhai Rabari, 2) Devjibhai Bababhai Rabari, 3) Keshiben Devjibhai Rabari	18.02.2022 & Rs. 9,04,529.59 as on 10.02.2022 as per w/s 13(2) Notice & Rs. 9,07,148.67 as on 21.05.2022 and interest & expenses thereon	All the piece and parcel of residential property bearing "Plot No. 4-5, Radhanpur Sim, Sher Bag Area, Near Lal Bag, Station Road, Radhanpur, District Patan - 385340, situated on the land area admeasuring 74.48 Sq. Meters, having Revenue Survey No. 479/1, City Survey No. 6655, Village Radhanpur, Taluka Radhanpur, District Patan - 384265 and bounded as under :- East: Society Internal Road, West: Bhil Samaj Road, North: Talay Road, South: Adjoining Res. Property.	23.05.2022
Dhairya Namkeen And Caterers, Proprietorship firm through it's Bhagwandas Bhimsen Kaknani, 2) Bhagwandas Bhimsen Kaknani, 3) Laxmiben Bhagwandas Kaknani	28.01.2022 & Rs. 11.32,119.38 as on 25.01.2022 as per u/s 13(2) Notice & Rs. 11,74,818.68 as on 23.05.2022 and interest & expenses thereon	All the piece and parcel of commercial property bearing Shop No. G-5, with built up area admeasuring 15.64 Sq. meters on the Ground Floor of the building known as "Shivam Commercial Complex", Opp. Japath Hotel, Bahucharaji Bypass Link Road, at Heduva Hanumant, Mehsana constructed over the land situated at Revenue Survey No. 146, of Village - Heduva Hanumant, District Mehsana - 384003 and bounded as under: East: Passage, West: Open Land, North: Shop No. G/6, South: Shop No. G/4.	23.05.2022
1) New Pruthvi Minerals, Partnership firm through it's Partner Yogeshbhai Bhailaibhai Raval, 2) Yogeshbhai Bhailaibhai	28.01.2022 & Rs. 10.48,643.11 as on 25.01.2022 as per u/s 13(2) Notice & Rs. 10,60,080.54 as on 23.05.2022 and interest	All the piece and parcel of residential property bearing Flat No. 7, 2nd Floor, "Jigar Apartment", Behind Dr. Majmudar's Hospital, Opposite Dr. G. K. Patel's Hospital, Jail Road, Mehsana - 384002, having built up area admeasuring 810 Square Feet on the second floor of the building known as "Jigar Apartment", constructed over the land of Revenue Survey No. 1790 Paikee, City Survey No. 4424, Sheet No. 135, Running No. 53, of Mahsana in the area known as Jail road of Mahsana.	24.05.2022

Authorised Officer, HDFC Bank Ltd.

Mehsana in the area known as Jail road of Mehsana - 384002 and

bounded as under :- East : Main door of the flat adjoined House - A/122,

West : Adjoined Dr. Majmudar's Hospital, North : Internal road of the

Society Adjoined House - A/128, South: Adjoined House 6.

3 sisters, 2 kids found dead in a well in Rajasthan

DEEP MUKHERJEE JAIPUR, MAY 28

THE BODIES of three sisters two of whom were pregnant and two children of the eldest one were found by police in a well near Jaipur district's Dudu on Saturday. Their family alleged that their in-laws may have killed them over dowry.

According to the family, Kalu Meena, 25, Mamta Meena, 23,

and Kamlesh Meena, 20, were married to three brothers from one family. While one of the dead children was four years old, the other was less than a month old, said the FIR.

"Prima facie, the incident appears to be suicide but the cause of death will be clear after the post-mortem examination. One of the women had also posted a status on WhatsApp that they were being troubled by their inlaws and that it was better to die.

Since the bodies have been recovered now and the family is giving a supplementary report, we will register a case under IPC Section 304B (dowry death) based on that," said Jaipur Rural

SP Manish Agarwal. Police registered a case against the women's husbands and in-laws under IPC Sections 498A (husband or relative of husband of a woman subjecting her to cruelty), 406 (punish-

ment for criminal breach of

trust) and 323 (punishment for voluntarily causing hurt). Some people from the in-laws' family have been detained.

According to the FIR, registered after a complaint by the father, the youngest of the three sisters, Kamlesh, had told him over the phone on the morning of May 25 that they were being beaten up by their husband and other relatives and feared for their life. They went missing the same day.

Patels Airtemp (India) Limited

Registered Office: 5th Floor, Kalpana Complex, Near Memnagar Fire Station Navrangpura, Ahmedabad - 380009

CIN: L29190GJ1992PLC017801 E-mail: share@patelsairtemp.com Phone: +91-2764286634/35 Fax: +91-2764286301, Website: www.patelairtemp.com

Sr.			Standalon	е		Consolidated	_
No.	Particulars	Quarter ended	Quarter ended	Year ended	Quarter ended	Quarter ended	Year ended
		31-03-2022	31-03-2021	31-03-2022	31-03-2022	31-03-2021	31-03-2022
		Audited	Audited	Audited	Audited	Audited	Audited
1	Total Income from operations	8,029.41	7,210.22	30,321.97	8,029.41	7,210.22	30,321.97
2	Other Income	60.73	17.07	112.47	60.73	17.07	112.47
3	Total Income (1+2)	8,090.14	7,227.29	30,434.44	8,090.14	7,227.29	30,434.44
4	Profit before Exceptional Items and Tax	449.35	424.61	1,683.43	447.47	424.61	1,679.83
5	Profit before Tax	449.35	424.61	1,683.43	447.47	424.61	1,679.83
6	Net Profit for the period	323.33	301.14	1,240.12	321.45	301.14	1,236.52
7	Total Comprehensive income for the period	333.98	288.73	1,240.33	332.10	288.73	1,236.73
8	"Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share)"	507.02	507.02	507.02	507.02	507.02	507.02
9	Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised)						×
	1. Basic (Rs.)	6.38	5.94	24.46	6.34	5.94	24.39
	2. Diluted (Rs.)	6.38	5.94	24.46	6.34	5.94	24.39

Notes:

1 The above Audited Standalone and Consolidated financial results for the Quarter and Year ended 31st March, 2022 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 28th May, 2022. The Statutory Auditors of

- the Company have carried out the audit of the above Financial Results and have issued Audit Report with Unmodified Opinion on the same 2 The Board of Directors, subject to the approval of the Shareholders in the ensuing Annual General Meeting, have recommended Dividend of Rs. 2.80/- per share of face value of Rs. 10/- each (i.e. 28%) on 50,70,240 Equity Shares of Rs. 10/- each for the financial year ended on 31st March, 2022.
- 3 The Consolidated Financial Results for the quarter and year ended on 31st March, 2022 comprises of Audited Financial Results of M/s. Patels Airtemp (India) Limited and management certified Financial Results of M/s. Patels Airtemp (USA) Inc., a wholly owned subsidiary (WOS) of
- 4 The above is an extract of the detailed format of Standalone & Consolidated Audited Financial Results for the Quarter and Year ended on 31st March, 2022 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 The full format of the Standalone & Consolidated Audited Financial Results for the Quarter and Year ended on 31st March, 2022 are available on the Stock Exchange website: www.bseindia.com and on the Company's website: www.patelsairtemp.com.

For and on behalf of the Board For Patels Airtemp (India) Limited Sd/-

Place: Rakanpur, Dist: Gandhinagar **Date**: 28th May, 2022

Narayanbhai G. Patel **Chairman & Whole Time Director** (DIN: 00023107)

STATE BANK OF INDIA

Raval, 3) Dharmesh

4) Kalaben Bhailalbhai

Date: 23.05.2022 & 24.05.2022

Place: Mehsana, Radhanpur & Patan

Yogeshbkai Raval,

Stressed Assets Recovery Branch (SARB) (18735) : 2st Floor, Administrative Office Building, Nilambaug Chowk, Bhavnagar, Gujarat - 364001, Phone No. 0278-2516251 & 2514051, E-mail: sbi.18735@sbi.co.in

& expenses thereon

PUBLICATION OF NOTICE REGARDING POSSESSION OF PROPERTY U/S 13(4) OF SARFAESI ACT 2002 Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of power conferred on him/her under section 13(4) of the said Act read with Rule 9 of the said Act on the dates mentioned against each account.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the STATE BANK OF INDIA for an amount and interest thereon.

Name of Proprietor/ Partners/Guarantors/ Owner of property etc.	Description of the property mortgaged/ charged	Date of Demand Notice	Date of Physical Possession	Amount Outstanding as per Demand Notice								
Anandbhai Virjibhai Jagani	All the piece & parcel of Residential Building at old Gamtal, Khojakhana Sheri, Vill - Mota Devaliya, Taluka - Babra, Dist: An	Building at old Gamtal, Khojakhana Sheri, 08.06.2016 24.05.2022 6.00.										
Babubhai Anandbhai Jagani		All the piece & parcel of Residential Building at Old Gamtal, Khojakhana Sheri, Vill- Mota Devaliya, Taluka - Babra, Dist; Amreli, Admeasuring 302.87 Sq. Meters.										
Babubhai Anandbhai Jagani and Nathabhai Anandbhai Jagani	Jagani, Old Gamtal, Khojakhana Sheri, Vill- Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Jagani, Old Gamtal, N	Mota Devaliy (hojakhana Sh	a, Taluka - Bat	ora, Dist : Amreli								
Satishbhai Valjibhai Mulsaniya	All that piece and parcel of residential building Near Janta Oil Mill, Opp. Water Tank, oli Gamtal, Vill - Mota Devaliya, Taluka - Babra, Dist: Amreli, Adm. 368.00 Sq. Meters.											
Hardashhai Govindhhai Kumbhani	All that piece and parcel of residential building at Khodiyar Nagar, Near Ramji Temple, Old Gamtal, Vill-Amrapara, Taluka - Babra, Dist: Amreli, Adm. 42.50 Sq. Meters											
Kumunam	not these said man titled and carried tologies.	and the same of th	or making product in the	.50 Sq. ivieters.								
	Partners/Guarantors/ Owner of property etc. Anandbhai Virjibhai Jagani Babubhai Anandbhai Jagani Anandbhai Jagani and Nathabhai Anandbhai Jagani Satishbhai Valjibhai Mulsaniya	Partners/Guarantors/ Owner of property etc. Anandbhai Virjibhai Jagani Babubhai Anandbhai Jagani Babubhai Anandbhai Jagani All that piece and parcel of Residential Bulding Jagani, Old Gamtal, Khojakhana Sheri, Vill-Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Jagani, Old Gamtal, Khojakhana Sheri, Vill-Babra, Dist: Amreli, Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Jagani, Old Gamtal, Khojakhana Sheri, Vill-Babra, Dist: Amreli, Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Jagani, Old Gamtal, Vill-Babra, Dist: Amreli, Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Jagani, Old Gamtal, Vill-Babra, Dist: Amreli, Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Jagani, Old Gamtal, Vill-Babra, Dist: Amreli, Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Jagani, Old Gamtal, Vill-Babra, Dist: Amreli, Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Jagani, Old Gamtal, Vill-Babra, Dist: Amreli, Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Jagani, Old Gamtal, Vill-Babra, Dist: Amreli, Admeasuring 209.05 sq. Meters. And Nathabhai Anandbhai Anandb	Partners/Guarantors/ Owner of property etc. Anandbhai Virjibhai Jagani Babubhai Anandbhai Jagani Babubhai Anandbhai Jagani	Partners/Guarantors/ Owner of property etc. Anandbhai Virjibhai Jagani Babubhai Anandbhai Jagani Babubhai Anandbhai Jagani Babubhai Anandbhai Jagani Anandbhai Jagani Babubhai Anandbhai Jagani All the piece & parcel of Residential Building at Old Gamtal, Khojakhana Sheri, Vill - Mota Devaliya, Taluka - Babra, Dist: Amreli, Admeasuring 211.53 Sci Babubhai Anandbhai Jagani All that piece and parcel of residential building Near Janta Oil Mill, Opp. Gamtal, Vill - Mota Devaliya, Taluka - Babra, Dist: Amreli, Adm. 368.00 St. Hardasbhai All that piece and parcel of residential building Near Janta Oil Mill, Opp. Gamtal, Vill - Mota Devaliya, Taluka - Babra, Dist: Amreli, Adm. 368.00 St. All that piece and parcel of residential building Near Janta Oil Mill, Opp. Gamtal, Vill - Mota Devaliya, Taluka - Babra, Dist: Amreli, Adm. 368.00 St. All that piece and parcel of residential building Near Janta Oil Mill, Opp.								



NILA INFRASTRUCTURES LIMITED

(CIN: L45201GJ1990PLC013417)

Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bunglow, Bodakdev, Ahmedabad - 380 015 Phone: +91 79 4003 6817/18 Fax: +91 79 26873922

E-mail: secretarial@nilainfra.com Website: www.nilainfra.com

				Standalone					Consolidated		
		Quarter Ended			Year Ended		Quarter Ended			Year Ended	
SN	Perticulars	31-03-22	31-12-21	31-03-21	31-03-22	31-03-21	31-03-22	31-12-21	31-03-21	31-03-22	31-03-21
	(Refer Notes below)	Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited
1	Total Income from Operations	2,756.53	2,744.05	3,841.53	10,613,31	11,111.22	2,435.59	2,535.67	3,864,19	9,422.82	10,596.05
2	Net Profit; (Loss) for the period (before Tax, Exceptional Items	171.43	100.27	590.42	364.85	117.48	139.54	54.25	613.75	176.56	93,65
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional (tems)	171.43	100.27	590.42	364,85	117.48	139.54	54.25	613.75	176.56	93.65
4	Net Profit) (Loss) for the period after tax (after Exceptional items)	122.21	73.33	433.77	251.02	48.19	(108.34)	23.91	464.98	(198.16)	(64.99)
5	Total Comprehensive Income for the period (Comprising Profit) (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	122.58	75.89	442.79	258.44	58.58	(107.97)	26,26	474.00	(190,74)	(55.60)
6	"Equity Share Capital (Face Value of ₹ 1)- per share!"	3,936.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89	3,938.89
7	Other Equity (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet)			100000	10,710.52	19,452.08				9,366.67	9,557.41
8	Earning per share of ₹ 1/- each (from Continuing and Discontinuing Operations)			T I							
	Basic (in ₹)	0.03	0.02	0.71	0.06	0.01	(0.03)	0.01	0.12	(0.05)	(0.02)
	Diuted lin ₹ 1	0.03	0.02	0.11	0.06	0.01	(0.03)	0.01	0.12	(0.05)	(0.02)

The above is an extract of the detailed format of quarter and year ended Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on May 27, 2022. and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarter and year ended Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and also on the Company's website at www.nileinfra.com.

Place: Ahmedabad Date: May 27, 2022 By Order of the Board of Directors Manoj B Vadodaria Chairman and Managing Director

Government of India Department of Atomic Energy **HEAVY WATER PLANT (BARODA)**

Notice Inviting e-Tenders The General Manager, Heavy Water Plant, Baroda invites on behalf of President of India on line item rate bids on two stage bid system for following work(s):

NIT No.	Name of the work	Estimated Cost	Earnest Money	Period of completion
MECH/ 21-22/	Overhauling maintenance, Supply & replacement of LT/CT cable & Cable	7,99,000/-	₹ 15,980/-	2 Months

trolley, Pendent with cable replacement, providing of walkway platform, painting and Load testing of 8 Ton Double Girder EOT crane in HWP (B) premises.

Last time and date of submission of bid: 18:00 hrs. of 13.06.2022. The bid forms and other details can be obtained from the website https://eprocure.gov.in/eprocure/app. The Press Notice is also available on www.hwb.gov.in

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contants. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals adversing in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.



INVESTMENT & PRECISION CASTINGS LTD

Nari Road, Bhavnagar, Gujarat 364 006. CIN: L27100GJ1975PLC002692 Phone: 0278-2523300, e-mail: direct1@ipcl.in

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR YEAR ENDED 31st MARCH, 2022

(Rs. In Lacs)

<u> </u>			STANDALONE						CONSOLIDATED				
	Sr. No.	Particulars	For the Quarter ended on			For the Year ended on		For the Quarter ended on			For the Year ended on		
			31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022	31.03.2021	31.03.2022	31.12.2021	31.03.2021	31.03.2022	31.03.2021	
			Audited	Unaudited	Audited	Audited	Audited	Audited	Unaudited	Audited	Audited	Audited	
8	1.	Total Income from Operations	3,593.75	3,192.09	3,627.34	13,202.65	10,466.36	3,593.76	3,192.09	3,627.34	13,202.65	10,466.36	
	2.	Net Profit/(Loss) for the period (Before Tax, Exceptional and/or Extraordinary Items)	(117.93)	(27.44)	404.01	23.72	64.05	(117.58)	(27.77)	402.27	23.02	58.23	
	3.	Net Profit/(Loss) for the period Before Tax (After Exceptional and/or Extraordinary Items)	(117.93)	(27.44)	404.01	23.72	64.05	(117.58)	(27.77)	402.27	23.02	58.23	
	4.	Net Profit/(Loss) for the period After Tax (After Exceptional and/or Extraordinary Items)	(82.71)	(23.04)	291.72	17.86	47.52	(82.36)	(23.37)	289.98	17.16	41.70	
	5.	Total Other Comprehensive income for the period Comprising Profit/(Loss)	7.11	(0.54)	3.05	5.49	(2.17)	7.12	(0.54)	3.05	5.50	(2.17)	
		for the period (after tax) and other comprehensive income (after tax)											
	6.	Paid up Equity Share Capital (Face Value of Rs.10/- per share)	500.00	500.00	500.00	500.00	500.00	500.00	500.00	500.00	500.00	500.00	
	7.	Reserves (excluding Revaluation Reserves) as shown in the				6,807.22	6,846.38				6,793.29	6,833.13	
		Audited balance sheet of the previous year											
	8.	Earning Per Share (EPS)											
		a) Basic	(1.65)	(0.46)	5.83	0.36	0.95	(1.65)	(0.47)	5.80	0.34	0.83	
		b) Diluted	(1.65)	(0.46)	5.83	0.36	0.95	(1.65)	(0.47)	5.80	0.34	0.83	

- 1. The above financial results are reviewed by the Audit Committee and taken on record at the meeting of the Board of Directors held on 28th May, 2022. The Statutory Auditors have carried out limited review of the same.
- 2. The Company has, in accordance with the Indian Accounting Standard (Ind AS) 108 Operating Segments, identified Investment Casting Activities and Power Generation Activities as its segments and financial details thereof are disclosed in a separate annexure attached herewith.
- 3. The statement has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognised accounting
- practices and policies to the extent Applicable. 4. The complaints from investors/shareholders for the quarter ended on 31st March,2022: Received -0, Resolved - 0, Unresolved - 0.
- 5. Previous period's figures have been reclassified, wherever necessary, to correspond with those of the current period. 6. Board has recommended dividend of 2.5% i.e. Rs.0.25/- per equity share on equity shares of Rs.10/- each.

Place: Bhavnagar Date: 28th May, 2022 By Order of the Board of Directors Mr. Piyush I. Tamboli Chairman & Managing Director

epaper.indianexpress.com

Ahmedabad